



# GUJARAT THEMIS BIOSYN LIMITED

**CIN: L24230GJ1981PLC004878**

REGD. OFFICE & FACTORY: 69/C GIDC INDUSTRIAL ESTATE,  
VAPI – 396 195, DIST. VALSAD, GUJARAT, INDIA

TEL: 0260-2430027 / 2400639

E-mail: [hrm@gtbl.in](mailto:hrm@gtbl.in)

GTBL: CS: BSE-CORR/2025-26/39

30<sup>th</sup> December, 2025

**The Manager**  
**Corporate Relationship Department**  
**BSE Limited**  
Floor 25, Phiroze Jeejeebhoy Towers  
Dalal Street, Mumbai- 400001  
Scrip Code – 506879

**The Manager – Listing Department**  
**National Stock Exchange of India Limited**  
Exchange Plaza,  
Bandra Kurla Complex,  
Bandra (East), Mumbai- 400051  
Symbol: GUJTHEM

Dear Sir / Madam,

**Sub: Newspaper Publication titled “Notice with respect to reminder about Special Window for re-lodgement of transfer requests of physical shares”.**

Dear Sir / Madam,

In furtherance to our intimation dated 16<sup>th</sup> October, 2025, and pursuant to SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated July 2, 2025, please find attached herewith the clippings of the newspaper publication titled “Notice with respect to Reminder about Special Window for re-lodgement of transfer requests of physical shares”, published in today's newspapers viz. 'Western Times' (English) edition and in 'Western Times' (Gujarati) edition dated Tuesday, 30<sup>th</sup> December, 2025. The same are also available on the Company's website at [www.gtbl.in](http://www.gtbl.in)

This is for your information and records.

For **Gujarat Themis Biosyn Limited**

**Vineet Gawankar**  
**Company Secretary & Compliance Officer**



PNB shares recover after fall after it reported Rs 2,434 crore loan fraud

Mumbai, Dec 29 (IANS) Shares of state-owned lender Punjab National Bank on Monday recovered after an earlier fall, after it reported a loan fraud of Rs 2,434 crore last week, allegedly committed by former promoters of SREI Equipment Finance Ltd (SEFL) and SREI Infrastructure Finance Ltd (SIFL). PNB's shares had fallen as much as 3.1 per cent to Rs 116.6 apiece earlier in the day, but were trading at Rs 120.55, up 0.15 per cent at 11:44 am. The PSU lender reported the loan fraud of Rs 2,434 crore to the Reserve Bank of India, alleging in a regulatory filing that the erstwhile promoters of SREI Equipment Finance Ltd and SREI Infrastructure Finance Ltd committed frauds of Rs 1,240.94 crore and Rs 1,193 crore, respectively.

The bank has made 100 per cent provisions against the entire outstanding amount, the filing added. The RBI, in October 2021, superseded the boards of SIFL and its wholly-owned subsidiary SEFL. However, Srei group has challenged the forensic audit report as the basis for the fraud classification, noting the matter is subjudice. Other banks such as Punjab & Sind Bank, Bank of Baroda, and Union Bank of India have also earlier declared a loan fraud in connection with Srei companies.

SEFL and SIFL, which carried combined financial debt of about Rs 32,700 crore, went through resolution under the Insolvency and Bankruptcy Code and were acquired by National Asset Reconstruction Company Ltd in December 2023. The PSU's shares showed robust performance across YTD, 1-year, 3-year and 5-year horizons up 17.43 per cent, 18.84 per cent, 117.60 per cent and 263 per cent respectively, despite a decline of 3.17 per cent in one month. PNB reported a 14 per cent rise in standalone net profit to Rs 4,904 crore for the September quarter of FY26 up from Rs 4,303 crore a year earlier.

Ola Electric faces tough year as market share drops over 50 pc in 2025

New Delhi, Dec 29 (IANS) India's electric two-wheeler market saw a major shift in 2025, with last year's leader Ola Electric losing a large part of its market share, while traditional auto companies strengthened their position. Ola Electric's market share dropped sharply to 16.1 per cent in 2025 from 36.7 per cent in 2024.

Despite overall demand for electric two-wheelers improving, the company sold 1,96,767 vehicles during the year, according to data from the government-run Vahan portal. The sharp fall highlights the growing challenges Ola Electric faced through the year. Ola Electric's troubles were also linked to operational issues, including customer complaints related to service delays and inconsistent deliveries.

Meanwhile, Bhavish Aggarwal-run electric two-wheeler maker reported a consolidated net loss of Rs

418 crore in second quarter of the current financial year (Q2 FY26).

The revenue from operations of the firm also followed suit and dropped nearly 43 per cent year-on-year to Rs 690 crore in Q2, compared to Rs 1,214 crore in Q2 FY25.



In an earlier exchange filing, the firm said that "For the Auto segment, we expect lower volumes than the Q1 guidance as we continue to focus on margin and cash discipline in a hyper competitive market. The stock of Ola Electric is also not performing well. Around 1:40 p.m., the company's shares were down 3.34 per cent at Rs

After 'two fugitives' remark, Lalit Modi issues apology to Indian government

New Delhi, Dec 29 (IANS) Former Indian Premier League (IPL) chairman Lalit Modi on Monday issued an apology to the Indian government, days after he referred to himself and liquor baron Vijay Mallya as the two "biggest fugitives" in a viral video, a comment that was widely perceived as a swipe at India.

In a post on X, Modi, however, did not clearly specify what exactly he was apologising for.

"I apologise if I have hurt anyone feelings especially the Indian Government who I have the highest respect and regard for. The statement was misconstrued and was never intended to be as played out. Once again my deepest apologies," he wrote.

The apology came after a video showing Modi at Mallya's lavish birthday party in London went viral last week. In the clip, Modi

was heard saying, "We are the two fugitives, the biggest fugitives of India."

Modi had himself shared the video on Instagram, captioning it, "Let me do something to break the internet down again. Something for you folks. Wat your heart out with envy (sic)." The post triggered sharp reactions online, with several users accusing Modi and Mallya of making a "mockery of the Indian government" and the country's legal system. Following the backlash, Modi deleted the video from his social media account.

Reacting indirectly to the controversy sparked by Modi's remarks, the Ministry of External Affairs (MEA) reiterated India's position that those wanted by law would be brought back to face justice.

"We remain fully committed that people who are fugitives, who are wanted

by law in India, they return to the country. For this particular return, we are in talks with several governments, and processes are on. In several of these cases, there are several layers of legalities involved. But we remain committed to bringing them back to the country so that they can face trial before the courts here," MEA spokesperson Randhir Jaiswal said. Both Lalit Modi and Vijay Mallya, who are facing serious charges in India, have been residing in the United Kingdom for several years.

Lalit Modi left India in 2010 after allegations surfaced against him relating to tax evasion, money laundering and proxy ownership linked to the lucrative IPL. The Enforcement Directorate has claimed that he manipulated the process of assigning IPL broadcast rights in 2009, allegedly in exchange for

kickbacks exceeding Rs 125 crore.

Vijay Mallya, the former chairman of United Breweries and promoter of the now-defunct Kingfisher Airlines, fled India in 2016 amid allegations of financial fraud.

He is accused of defaulting on multiple bank loans and is said to owe Indian banks around Rs 9,000 crore.

In 2019, Indian authorities declared Mallya a "fugitive economic offender", a designation that he has challenged in the High Court.

The two high-profile businessmen were last seen together in July at a lavish private gathering in London, where they were filmed singing Frank Sinatra's "My Way".

The karaoke evening was hosted by Lalit Modi as his "annual summer party" and was attended by more than 300 guests.

India's petrochemical demand to remain robust in medium term: Report

New Delhi, Dec 29 (IANS) India's petrochemical consumption growth is expected to remain robust at 6-7 per cent per annum in the medium term, driven by economic expansion and downstream product demand, according to a report released on Monday. Against this backdrop, reducing reliance on imports is viewed as a key strategic aim. Consequently, both public and private-sector companies have developed aggressive plans to increase their petrochemical capacity, said the CareEdge Ratings report.

Polypropylene capacity is expected to rise 1.8 times between FY25-FY30, surpassing the envisaged demand growth of 1.4 times, which could largely eliminate import dependence by FY30, the report states. "However, improving cost competitiveness, leading to a re-

covery in the trajectory of spreads and thereby earning reasonable returns on their investments, would remain the key monitorable for domestic petrochemical players," said Rabin Bihani, Associate Director, CareEdge Ratings. Prices and spreads in the domestic petrochemical sector are expected to remain weak in the near term due to global oversupply. There has been marginal recovery in spreads in H1FY26 which could support approximately 200 bps improvement in EBITDA margin in FY26. "However, sustained recovery and achievement of optimum operating profitability would hinge more on their cost competitiveness, global demand-supply scenario and need-based support from the Government given sizeable global capaci-

ty additions especially by China, which has impacted the profitability of Indian manufacturers for an extended period of time", said Hardik Shah, Director, CareEdge Ratings. The report states that the consumption of major petrochemicals, comprising of polymers, including Polypropylene (PP), High Density Polyethylene (HDPE), Low Density Polyethylene (LDPE), Linear Low Density Polyethylene (LLDPE), Polyvinyl Chloride (PVC), aromatics and elastomers, have witnessed a healthy growth in India over the past few years and the same is expected to sustain going forward. However, domestic capacity additions during this period remained limited, resulting in a high dependence on imports to meet increased domestic consumption.

Business Brief

Silver rally reflects physical supply deficit; prices likely to touch Rs 2.46 lakh per kg

New Delhi, Dec 29 (IANS) The silver market underwent a decisive structural shift in 2025, driven by prolonged physical supply deficits, inventory depletion and policy-led supply constraints, a report said on Monday. The report from Motilal Oswal Financial Services Ltd predicted that silver would touch Rs 2,46,000 per kg in the domestic market. The brokerage continues "to maintain a buy-on-dips approach with a staggered investment strategy."



"While the initial target of \$75 on COMEX has been achieved, the firm reiterates its target of \$77 on COMEX, equivalent to Rs 2,46,000 on the domestic market, with further revisions dependent on evolving market conditions," the report said. The rally was not merely speculative but reflected "deep stresses between paper pricing mechanisms and physical availability," with mounting physical tightness and declining exchange inventories reinforcing that the rally is structural rather than cyclical. "The widening disconnect between paper pricing and physical availability highlights deeper stress in global price discovery mechanisms," said Navneet Damani, Head of Research – Commodities at Motilal Oswal Financial Services Limited. Manav Modi, Commodities Analyst – Motilal Oswal Financial Services Ltd., said that persistent inventory drawdowns across key global hubs, weakening arbitrage between Shanghai and COMEX, and repeated delivery pressures have exposed the limited availability of deliverable silver. The report noted that CY25 marked the fifth consecutive year of physical deficit in the silver market, with mine supply unable to match combined industrial and investment demand. Silver prices surged to record levels during the year, crossing \$75 on COMEX and rising above Rs 2.3 lakh in the domestic market, marking gains of over 160 per cent.

CHANGE OF NAME

I have changed my old name from **MOHAMMEDSHARIF JANMOHAMMED SHAIKH** to new name **MOHAMMADSHARIF JANMOHAMMAD SHAIKH**  
Add. 1200, Biskit Gali, Pankomaka Nr. Three Gate, Ahmedabad 4083

CHANGE OF NAME

I have changed my old name from **MOHMEDHUSEN AHMEDBHAI SHAIKH** to new name **MOHAMMEDHUSAIN AHMEDMIYA SHAIKH**  
Add. 2772,D Juliawada Bahai Center Shaphur Ahmedabad-380001 4084

CHANGE OF NAME

I have changed my old name from **ZIBA SONALBEN AMITKUMAR** to new name **ZIBA SONAL AMITDAN**  
Add. G-802, Poornam Residency Kudasas, Gandhinagar 4085

CHANGE OF NAME

I have changed my old name from **JAIDEV RANDEPSINGH PURVANI** to new name **JAIDEVSINGH RANDEPSINGH PURDHANI**  
Add. 903, Satkrut, Parthasarthi Avenue, Near Shyamal Corss Road, Satellite Ahmedabad-380015 4086

CHANGE OF NAME

I have changed my old name from **DIPAK KANAIALAL PATDIYA** to new name **DEEPAK KANAIALAL SONI**  
Add. 5, Nemnath Soc, Paldi Ahmedabad-7 4087B

CHANGE OF NAME

I have changed my old name from **JAY DIPAKKUMAR PATDIYA** to new name **JAY DEEPAK SONI**  
Add. 5, Nemnath Soc, Paldi Ahmedabad-7 4087

CHANGE OF NAME

I have changed my old name from **DEEPIKABEN ISHAVARLAL SONI** to new name **DIPIKA DEEPAK SONI**  
Add. 5, Nemnath Soc, Paldi Ahmedabad-7 4087A

NOTICE

I Kirtidaben Mahendrabhai Leuva declare my name Kirtidaben Mahendrabhai Leuva & Kirtidababen Mahendrabhai Leuva both the names belongs to one, correct & same person.  
Add. :- 35, Samrathnagar, Hansol, Sardarnagar, Ahmedabad.

CHANGE OF NAME

I have changed my old name from **RAMESHKUMAR MANEKLAL PANCHAL** to new name **RAMESHCHANDRA MANEKLAL PANCHAL**  
Add. 9, Prerna Bungalows, Nikol, Ahmedabad 4088

CHANGE OF NAME

I have changed my old name from **VASIMAHAMAD HABIBURRAHEMAN KHANUSHIYA** to new name **VASIMAHMED HABIBURREHMAN KHANUSHIYA**  
Add. At. Mangadh, Ta. Idar, Dist. Sabarkantha-383110 V014

CHANGE OF NAME

I have changed my old name from **JASWANI RAVI RAMCHANDBHAI** to new name **RAVI RAMBHAI JASWANI**  
Add. N-204, Kailashraj Hights, Kubernagar Ahmedabad-382340 4089

CHANGE OF NAME

I have changed my old name from **ANKITA NAINESH PATEL** to new name **ANKITABEN NAINESHKUMAR PATEL**  
Add. A-2, Shrushti Appartment, Ghodasdar Ahmedabad-380050 4089B

**GUJARAT WATER SUPPLY & SEWERAGE BOARD**  
**SECTOR-10/A, GANDHINAGAR**

**TENDER NOTICE**

On-line tender thorough E-tendering are invited by the Tech. Cell, GWSSB, Jalseva Bhavan, Sector-10-A, Gandhinagar for **Appointment of Project Management Consultancy (PMC) including Supervision Services for Water Supply Projects in Gujarat State**. Estimated Cost Rs.30.00 Crores (Rs.Thirty Crores Only). Last date of on-line submission on website shall be up to 18:00 hours on date 16/01/2026 For more details please visit website. <https://www.tender.nprocure.com> For any problem of Rural Area Water supply please contact GWSSB Helpline No.1916

INF/2218/2025-26

PUBLIC NOTICE

It is hereby informed to the Public through this Notice that Property being City Survey No. 584 Adm. 109.1 Sq. Mtrs. Known as Chok Sheri Situated at :- City Survey No. 584 of Mouje : Sarkhej, Taluka : Vejalpur, District : Ahmedabad 4 (Paldi) at present owned and possessed by Bhariben Bholanath Shukla. Further it is to be state that Original Registered Sale Deed and its Registration Receipt (Sr. No. 2801 on Dt. 10/02/1976) of (1) Mahendraprasad Harishankar Tripathi and (2) Urvashi Mahendraprasad Tripathi are not available with the said Bhariben Bholanath Shukla and which are misplaced and or Lost through an Oversight and or Mistake as informed by Bharitiben Bholanath Shukla and also declared by them that said Property is free from all encumbrances and titles of the said Property are clear, marketable and transferable and Bharitiben Bholanath Shukla has not created any charge over the said property and therefore they have demand the No Objection Regarding Lost of Original Registered Sale Deed and its Registration Receipt Under Sr. No. 2801 on Dt. 10/02/1976. In case anybody has any prior charge, lien or an interest of any nature in respect of the said property, should inform about such charge, lien or interest with sufficient Documentary evidence regarding the same within 7 days from the date of this notice failing which it will be construed that Titles of the property in favour Present owner Bharitiben Bholanath Shukla are absolute clear and marketable and no party has any charge, lien, interest or any claim of whatsoever nature in the said property which please note.  
**Date-29-12-2025** **Kashyap K. Bhatt Advocate**  
**Address :- 23, Satyanarayan Society Part 2, Jivraj Park, Ahmedabad 380 051**  
**Place- Ahmedabad**

**WESTERN RAILWAY EXTENDS TRIPS OF VARIOUS SPECIAL TRAINS**

TRAIN NO.	ORIGINATING STATION & DESTINATION	DAYS OF RUN	EXTENDED UPTO
09215	Gandhigram – Bhavnagar Terminus	Daily	28.02.2026
09216	Bhavnagar Terminus – Gandhigram	Daily	28.02.2026
09211	Gandhigram – Botad	Daily	28.02.2026
09212	Botad – Gandhigram	Daily	28.02.2026
09529	Dhola – Bhavnagar Terminus	Daily	28.02.2026
09530	Bhavnagar Terminus – Dhola	Daily	28.02.2026

For detailed information regarding timings, halts and composition, passengers may please visit [www.enquiry.indianrail.gov.in](http://www.enquiry.indianrail.gov.in)

**WESTERN RAILWAY**  
www.indianrailways.gov.in  
Like us on [Facebook](https://www.facebook.com/WesternRly) WesternRly  
Follow us on [Instagram](https://www.instagram.com/WesternRly) WesternRly

**PLEASE CARRY ORIGINAL ID PROOF FOR ALL RESERVED TICKETS**

**GUJARAT THEMIS BIOSYN LIMITED**  
CIN: L24230GJ1981PLC004878  
69/C, GIDC Industrial Estate, Vapi - 396 195, Dist. Valsad, Gujarat, Tel: +91 260 2430027  
Fax: +91 260 2400639 E-mail: [gtblmumbai@gtbl.in](mailto:gtblmumbai@gtbl.in) Website: [www.gtbl.in](http://www.gtbl.in)

**Notice to Shareholders**

Reminder - Special window for re-lodgment of transfer requests of physical shares

In furtherance to our public notice dated 15<sup>th</sup> October, 2025 with respect to one-time special window offered pursuant to Securities and Exchange Board of India ("SEBI") circular SEBI/HO/MIRSD/MIRSD-PoD/P/CIR/2025/97 dated 2<sup>nd</sup> July, 2025, we hereby reiterate that the special window for re-lodgment of transfer requests in case of physical shares is open till 6<sup>th</sup> January, 2026. This special window facility is applicable to those cases where original share transfer request prior to 1<sup>st</sup> April, 2019 were rejected or returned / unattended due to deficiencies in documents, process or any other reason.

Please note that re-lodged requests for transfer of equity shares shall be processed only in the form of dematerialized form, subject to successful verification of documents. Eligible shareholders may submit their request along with the requisite documents to the Company's Registrar and Share Transfer Agent ("RTA") at MUFG Intime India Private Limited (formerly known as Link Intime India Private Limited) C-101, Embassy 247, L.B.S. Marg, Vikhroli (West), Mumbai – 400083. We encourage all investors to initiate necessary actions without delay to regularize pending transfer cases.

For, **GUJARAT THEMIS BIOSYN LIMITED**  
Sd/-  
Vineet Gawankar  
Company Secretary & Compliance Officer

Place: Mumbai  
Date : 29-12-2025

**GUJARAT WATER SUPPLY & SEWERAGE BOARD**

**TENDER NOTICE NO. 09 OF 2025-2026 (ID No. 257678, 257790)**

Executive Engineer, Public Health Works Division, GWSSB Surat : (Ph.0261-2782088) invites online tenders through E-tendering **Single bid** system from registered contractors in "A class & above R & B Department/ Irrigation Department for the work with GWSSB under work of Request for Empanelment of basis for O & M of Regional Water Supply Schemes for, Umra & Vanskui works day of **05 Year** under **Surat** ID-number of four (02) works. For the Range of estimated amounting **Rs. 9.54/- Crore** For further details of tender notice, scope of work tender fee, EMD and specification etc. Please visit Web Websites <http://gwssb.nprocure.com>. The last Date of online bid submission **Dt. 15/01/2026** up to 15.00pm hrs. & Tender Documents submission is to be made through **RPAD/ SPEED POST** so as to Reach Before 15:00 pm of **Dt: 16/01/2026** Dept. Reserves the right to reject any one or all tenders without assigning any reason. Now onwards, all the improvements/ correction in the tender shall be done online only. For any query regarding water supply problem, please call on helpline number-1916 **Mahiti-Surat/1262/2025**

**GIDC Gujarat Industrial Development Corporation**

**Public Notice**

Notice is hereby given to inform that the residential Plot No. **1505**, admeasuring **300.00 sq. meters**, as shown in the schedule below, belonged to **Late Moiz Qurbanhusain Jadiwala**, who expired on **21/12/2018**. As his legal heir in the direct line of succession, **Asif Moiz Jadiwala** is entitled to the said property, and the same is being **transferred in his favor**.

All persons having any claim in respect thereof by way of sale, exchange, gift, mortgage, charge, trust, inheritance, possession, lease, lien or otherwise howsoever are requested to inform the same in writing to the undersigned having the office at the address as follows within 10 days from today.

**Office of the Regional Manager,**  
GIDC Admin Building, Plot no. 624/B, Valia Road, GIDC, Ankleshwar-393 002, Gujarat.

**Schedule Above Referred to**  
Residential Plot No. **1505**, Area: **300.00 sq. mtr**, GIDC Ankleshwar, Dist. Bharuch, Taluka Ankleshwar - 393 002.

S/d  
Place: Ankleshwar Regional Manager  
Date: 29/12/2025 GIDC, Ankleshwar

**No: INF/BCH/668/2025**

**GIDC Gujarat Industrial Development Corporation**

**Public Notice**

Notice is hereby given to inform that the residential Plot No. **1504**, admeasuring **300.00 sq. meters**, as shown in the schedule below, belonged to **Late Moiz Qurbanhusain Jadiwala**, who expired on **21/12/2018**. As his legal heir in the direct line of succession, **Asif Moiz Jadiwala** is entitled to the said property, and the same is being **transferred in his favor**.

All persons having any claim in respect thereof by way of sale, exchange, gift, mortgage, charge, trust, inheritance, possession, lease, lien or otherwise howsoever are requested to inform the same in writing to the undersigned having the office at the address as follows within 10 days from today.

**Office of the Regional Manager,**  
GIDC Admin Building, Plot no. 624/B, Valia Road, GIDC, Ankleshwar-393 002, Gujarat.

**Schedule Above Referred to**  
Residential Plot No. **1504**, Area: **300.00 sq. mtr**, GIDC Ankleshwar, Dist. Bharuch, Taluka Ankleshwar - 393 002.

S/d  
Place: Ankleshwar Regional Manager  
Date: 29/12/2025 GIDC, Ankleshwar

**No: INF/BCH/667/2025**



## નેત્રંગ નગરમાં મુખ્ય રોડ રસ્તાઓ પર હલકી કક્ષાના પેવર બ્લોક ફીટ થાય તે પહેલા જ સાંસદે કામ અટકાવ્યું

(પ્રતિનિધિ) ભરૂચ, નેત્રંગ નગરનો મુખ્ય રોડ ભાવના પાન સેન્ટરથી લઈને વનવિભાગની કચેરી સુધી ગત વર્ષે સીસી રોડની કામગીરી જીલ્લા સાંસદની ગાન્ટ માંથી નવનિર્માણ કરવામાં આવેલ આ રોડની કામગીરી સમયે સ્થાનિક જવાબદાર પદાધિકારીઓ થકી રોડની કામગીરી કરનાર જેતે એજન્સી થકી ચાલતી કામગીરી બાબતે ચોક્કસાઈ પૂર્વક સીધી દેખરેખ રાખવામાં નહિ આવતા બે ગોબાચારી થતા દુક સમયમાં આ સીસી રોડ બેહાલ થતા સ્થાનિક રહીશોએ ભારે વિરોધ કરાતા અને રસ્તા સારો બને અને લોકની સમસ્યાનું નિરાકણ થાય તે માટે હાલમાં ફરીવાર આજ રસ્તા પર લાખો રૂપિયાની લાગતથી સારી ગુણવત્તા અને ભારેખમ વાહનોની ભારસમતા ખમે એવા પેવર બ્લોક નાખવાનું નક્કી થતા લાખો



(તસ્વીર: વિરલ રાહા, ભરૂચ)

રૂપિયાની કામગીરી ગુણવત્તા વાળી થાય તે માટે ટેન્ડર બહાર પાડી સારી એજન્સી જવાબદારી પૂર્વક કામ કરે તે હેતુને સાઈડ પર મુકીને પેવર બ્લોકની કામગીરીના પાંચ લાખથી અંદરના એસટીમેન્ટ પ્લાન તૈયાર કરાવી કામગીરી કરવાની પેરવલી કરી હલકી કક્ષાના પેવર બ્લોક લાવી કામગીરી શરૂ થવાની ભીતી સેવાતા નગરજનોએ ભરૂચ સાંસદ મનસુખ

વસાવાને રજુઆત કરતા આજ રોજ નેત્રંગ ખાતે આવી કામગીરી અટકાવી દીધી હતી અને હલકી કક્ષાના પેવર બ્લોક તાત્કાલિક હટાવી લેવા ફરમાન કરાતા પેવર બ્લોકના કરેલા ઢગલા ઉઠાવી લેવાની ફરજ પડી હતી.હાલતો કામગીરી અટકી ગઈ છે અને જીલ્લા સાંસદે ફાળવણી કરેલ ગાન્ટ પણ અટકાવી દીધી છે.

### વીરાવાડા ગામથી કેમાઈ સુધી

## રૂ. ૭૦ લાખના ખર્ચે બનનાર જાહેર માર્ગનું હિંમતનગરના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

(પ્રતિનિધિ) હિંમતનગર, હિંમતનગર તાલુકાના વીરાવાડા ગામે આરોગ્ય કેન્દ્રથી કેમાઈ તરફ જતા જાહેર માર્ગ સુવિધા પથના અંદાજિત રૂ. ૭૦ લાખના વિકાસકામનું ખાતમુહૂર્ત તેમજ પ્રાથમિક શાળા,આરોગ્ય કેન્દ્ર અને ગામના સામુહિક ઉપયોગમાં આવતાં અંદાજિત રૂ. ૭ લાખના માર્ગનું લોકાર્પણ હિંમતનગરના લોકપ્રિય ધારાસભ્ય વી.ડી.ઝાલા ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલાએ જણાવ્યું હતું કે નવનિર્મિત માર્ગના લોકાર્પણથી ગ્રામજનો, વિદ્યાર્થીઓ, દર્દીઓ તેમજ આસપાસના વિસ્તારોના લોકોને સરળ,સુરક્ષિત અને સુગમ વાહનવ્યવહારની સુવિધા ઉપલબ્ધ



(તસ્વીર: મંગળાવત વણગરા, હિંમતનગર)

બનશે.પરિણામે ગામના સર્વાંગી વિકાસને નવી ગતિ અને દિશા મળશે. આ લોકાર્પણ પ્રસંગે હિંમતનગર તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ,બશીરપંચ મોરચાના પ્રમુખ વનરાજસિંહ રાઠોડ, પ્રતિષ્ઠિત રોડ કોન્ટ્રાક્ટર

ગણપતભાઈ પટેલ,વીરાવાડા ગામના સરપંચ શમિષ્ઠાબેન પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પી.એચ.સી.)ના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

## નડિયાદમાં સરદાર પ્રતિમા પાસે ૧૪ ફૂટ પહોળા કાંસની સફાઈ હાથ ધરાશે

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં ગયા સપ્તાહે સરદારની પ્રતિમા પાસે આવેલ જર્જરિત સરદાર ભુવનની ૪૬ દુકાનોને ઉતારી પાડવામાં આવી હતી. એ બાદ આ દુકાનોનો કાટમાળ હટાવી આજે સોમવારે રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે અને વાહનવ્યવહાર પૂર્વવત કરાયો છે. આજે ધારાસભ્ય પંકજ દેસાઈ અને ડેપુટી કમિશનર રૂરેશ હુડેડ સ્થળની મુલાકાત લીધી હતી. અગાઉ કાંસ પર બ્લોક બનાવ્યા હતા ત્યાં મજૂરો મારફતે વાંસ નાખીને ચકાસણી કરતા જાણવા મળ્યું કે કાંસમાં પાણી એન્ડ-૬ ફુટમાં જ જઈ રહ્યું છે. માટે હવે મહાનગરપાલિકા આ કાંસને ખુલ્લો કરી સફાઈ કરવામાં આવશે તેમ ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું છે.

નડિયાદ શહેર પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાયેલું છે. પૂર્વ ભાગનો મુખ્ય વરસાદી પાણીનો નિકાલનો કાંસ શહેરના મધ્યભાગથી પસાર થાય છે. પારસ સર્કલ, સંતરામ મંદિર પાછળ થઈને બસ સ્ટેન્ડ તરફ અને ત્યાંથી સરદારની પ્રતિમા થઈને આગળ માહિતી ભવન સુધી જાય છે. સરદારની પ્રતિમા પાસે કાંસ પર વર્ષ ૧૯૬૧-૬૨માં દુકાન પાડવામાં આવી હતી. જેને સરદાર ભુવન કોમ્પ્લેક્ષ નામ અપવામાં આવ્યું હતું. જોકે છેલ્લા ઘણા વર્ષોથી આ કાંસ સફાઈ ન થવાથી ચોકઅપ થઈ જતાં વરસાદી પાણીનો નિકાલ થઈ રહ્યો નહોતો. જેના કારણે નગરના પૂર્વ ભાગમાં વરસાદી પાણીનો ભરાવો હતો અથવા તો ધીમી ધારે વરસાદી પાણીનો નિકાલ થતો હતો.

આ ઉપરાંત સરદાર ભૂવન કોમ્પ્લેક્ષ પણ જર્જરિત હાલતમાં હોવાથી મોટી જાનહાનિ થાય તેવી શક્યતા જોતા નડિયાદ મહાનગરપાલિકાએ ગયા સપ્તાહે આ કોમ્પ્લેક્ષને ઉતારી દીધું હતું. આ બાદ કાટમાળને હટાવી આજે સરદાર પ્રતિમા પાસેનો રોડ વાહનવ્યવહાર માટે પૂર્વવત કર્યો છે.

બીજી તરફ મહાનગરપાલિકાના ડેપુટી કમિશનર રૂરેશ હુડેડ અને ધારાસભ્ય પંકજ દેસાઈએ આજે સોમવારે સ્થળની મુલાકાત લીધી હતી. જ્યાં અગાઉ પાડેલા બ્લોકમાં મજૂરો મારફતે વાંસ નાખી સમગ્ર કાંસની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૧૪ ફૂટ પહોળો અને ૮ ફૂટ ઊંડા કાંસમાં કામ ઉપલા ધેવલથી એટલે કે એક-દોઢ ફૂટ ઉપરથી જ પાણી પસાર થાય છે બાકી તમામ જગ્યાઓ ચોકઅપ થયેલુ જણાવા મળ્યું છે. તેમ ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે, હવે આ જગ્યા પરનો કામ મહાનગરપાલિકા દ્વારા હાલના તંકમ્ સ્લેબ તોડી સફાઈ કરવામાં આવશે. આ કાંસ પૂર્વ વિસ્તારનો મુખ્ય કાંસ છે અહીંયા સફાઈ કરાયા બાદ જ આગળ ક્યાં ચોકઅપ છે તે માલુમ પડશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, અહીં

### વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વધુ ઝડપી થશે

નવી સ્લેબ ડ્રેનજ ૬૮ કરોડના ખર્ચે મંજૂર પણ થઈ છે. આ કાંસ શહેરનો મુખ્ય કાંસ છે અને સમગ્ર શહેરનું પાણી બહાર લઈ જતો કાંસ છે જે આગળ કમળા થઈને શેઠી નદીમાં મળે છે. અહીંયા સરદારની પ્રતિમા પાસે કોમ્પ્લેક્ષની નીચે કાંસ પર પાણી અટકતા આ કાંસ પર અગાઉ કોર્પોરેશન દ્વારા કોમ્પ્લેક્ષની દુકાનોમાં બ્લોક બનાવી ભારે મશીનરીનો ઉપયોગ કરી દુકાનોને નુકશાન ન થાય તે રીતે કાંસ સફાઈ કરવાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું. જોકે તે

સમયે સફાઈમાં જોઈએ તેવી સફળતા મળી નહતી. આ બાદ ટેકનીકલ રીમોએ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ કોમ્પ્લેક્ષ નીચેનો સમગ્ર કાંસ ચોકઅપ છે. જેના કારણે સમગ્ર શહેરમાં એટલે કે દેસાઈ વગેરે, જુના માખણપુરા, વીકેવી રોડ, રાહુલ હોસ્પિટલ રોડ, સંતરામ રોડ સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા હતા અને ધીમીધારે નીકાલ થતો હતો. આ વિસ્તારોમાં હોસ્પિટલો પણ આવેલી હોવાથી દર્દીઓ અને નગરજનો પણ ચોમાસાની સિઝનમાં ભરે હાલકી ભોગવતા હતા. જોકે ભારે કાંસ પરની જર્જરિત દુકાનો દુર કરી દીધી છે અને હવે કાંસના સ્લેબ તોડી સફાઈ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

### આણંદ જિલ્લા માટે ગૌરવની ક્ષણ: રાજ્ય કક્ષાએ "શ્રેષ્ઠ જિલ્લા શાખા" તરીકે સન્માનિત



(પ્રતિનિધિ) આણંદ, પ્રજાચક્ષુ તથા દિવ્યાંગ વ્યક્તિઓના ઉત્થાન માટે કાર્યરત દેશની સૌથી મોટી રાષ્ટ્રીય સંસ્થા ચરાષ્ટ્રીય અંધજન મંત્રણ (NAB) દ્વારા આમારી આણંદ જિલ્લા શાખાને સમગ્ર ગુજરાત રાજ્યની તમામ જિલ્લા શાખાઓમાં 'શ્રેષ્ઠ શાખા' તરીકે જાહેર કરવામાં આવી

રાજકોટ ખાતે આયોજિત ગૌરવપૂર્ણ સમારોહમાં xસ્વ.

પ્રવિણભાઈ યુનીલાલ દાંડીયા બેસ્ટ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચ એવોર્ડ ૨૦૨૫x અંબાવત થયો છે. આ સફળતાનો શ્રેય પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પટેલ તથા મંત્રીશ્રી ચંદ્રકાંતભાઈ કે. સોલંકી, સમગ્ર કર્મચારીઓ અને એવા દરેક વ્યક્તિને જાય છે જેમણે પ્રત્યક્ષ કે પોક્ષ્ય રીતે અમને સાથ આપ્યો છે. આ એવોર્ડ માત્ર એક સન્માન નથી, પણ સેવાની જ્યોતને વધુ પ્રજ્વલિત કરવાની જવાબદારી છે.

### પશ્ચિમ રેલવે - અમદાવાદ

જાહેર સુના આથી જાણ કરવામાં આવે છે કે મોટી આદરજ-વિજાપુર સેક્શનની વચ્ચે મોટી આદરજ-વિજાપુર ગેજ કન્વર્ઝન પર નવી બિહાલેલી બીજી લાઈન પર પેસેન્જર અને માલગાડીઓ ચાલુ થશે અને 29.12.2025 અને 30.12.2025ના રોજ C R S નિરીક્ષણ કરવામાં આવશે. 30.12.2025ના રોજ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રાયલ રન પણ કરવામાં આવશે સામાન્ય જનતાને રેલવે ટ્રેકથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવે છે.

રેલવે ટ્રેક કસરો અથવા રેલવે ટ્રેકની નજીક અવરજવર કરવી જીવલેણ બની શકે છે. CPM 105

અમો તાઉ કહો: f facebook.com/WesternRly - અમો શ્રોતો કહો: X twitter.com/WesternRly

### પશ્ચિમ રેલવે - અમદાવાદ

જાહેર સુના રેલવે પરિસરના તમામ વપરાશકર્તાઓને જાણ કરવામાં આવે છે કે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળના DRM કાર્યાલય - અસારવા ખાતે નવા નિયંત્રણ કાર્યાલય માટે નવું સ્થાપિત ૧૧/૦.૪૩૩ kV હાઈ ટેન્શન પાવર સબસ્ટેશન 0૫.0૧.૨૦૨૬ના રોજ અથવા તે પછી સક્રિય કરવામાં આવશે. તે તારીખથી, આ પાવર સબસ્ટેશન કંપેક્ષ લાઈવ મુકાવમાં આવશે, અને કોઈપણ અનધિકૃત વ્યક્તિએ આ પરિસરની નજીક અથવા સંપર્કમાં કામ કરવું જોઈએ નહીં.

વિભાગ	તારીખ
વિષય: અમદાવાદ મંડળ હેઠળના D R M કાર્યાલય - અસારવા ખાતે નવા નિયંત્રણ કાર્યાલય માટે નવા સ્થાપિત ૧૧/૦.૪૩૩ kV હાઈ ટેન્શન પાવર સબસ્ટેશનનું નિયમિત સક્રિયકરણ	0૫.0૧.૨૦૨૬

અમો તાઉ કહો: f facebook.com/WesternRly - અમો શ્રોતો કહો: X twitter.com/WesternRly

## કાંકરિયા કાર્નિવલમાં ૧૯ ફૂડ સ્ટોલમાંથી ખાદ્ય નમૂનાઓ લેવાયા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કાંકરિયા કાર્નિવલ-૨૦૨૫ દરમિયાન જાહેર આરોગ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે કાંકરિયા કાર્નિવલ ખાતે આવેલા ફૂડ સ્ટોલમાંથી વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ મુજબ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. મ્યુનિસિપલ હેલ્થફૂડ વિભાગ ધ્વારા મુખ્યત્વે ઢોકળા, ફલેવરડ

મિલ્ક, છાસ, મોમોઝ, ચના ચોર ગરમ, ખીચુ, જામુન શોટ, બ્લેક ફોરેસ્ટ પેસ્ટ્રી, ખીરુ, દાખેલી માવો, મિલ્ક શેક, જીરા પુરી, ચાટ, મિલ્ક ટોસ્ટ, સમોસા, ફરસી પુરી, કચોરી તથા જીણી સેવ જેવા ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. આ નમૂનાઓ કાંકરિયા કાર્નિવલ ખાતે આવેલા ફિન્ના મદ્રાસ કાફે, અમુલ, મુલરાજ કેટરર્સ, મિટ્ટી કિચન, કાઉન બેકરી, ઈડલી ઘર ફૂડ્સ પ્રા.લિ., બોમ્બે ભાજપાઉ એન્ડ સ્ટ્રીટ ફૂડ અને આપણો રાજસ્થાન સહિતના વિવિધ ફૂડ સ્ટોલમાંથી લેવામાં આવ્યા છે.

## ઉત્તરાયણ પહેલા પતંગ ચગાવવા માટે ઘાબે ચઢ્યો અભિષેક શર્મા

(એજન્સી) જયપુર, ભારતીય ક્રિકેટ ટીમનો બેંટર અભિષેક શર્મા વિજય હજારે ટ્રોફીની મેચ પહેલા જયપુર પહોંચ્યો છે. ઉત્તરાયણ પહેલા પતંગ ચગાવવા અભિષેક શર્મા ઘાબે ચઢ્યો હતો. મૈયાના એક દિવસ પહેલા રવિવારે (૨૮ ડિસેમ્બર) પિક્સિટી જયપુરના પરકોટમાં શર્માએ પતંગ ઉડાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. અભિષેક શર્મા પેચ કાપી બૂમો પાડતો અને ચિકીની જયાફત માણતો જોવા મળ્યો હતો. અભિષેક તેના કેટલાક સાથી ખેલાડીઓ સાથે પરકોટ સ્થિત બ્રહ્મપુર વિસ્તારમાં એક ઘરના ધાખા પરથી પતંગ ઉડાવતો હોવાનો

વીડિયો વાઈરલ થયો છે. જેમાં પેચ કાપતા અભિષેકે એ કાપ્યો... બૂમો પાડીને પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો.

પતંગ ઉડાવતી વખતે અભિષેકે જયપુરના પારંપરિક સ્વાદનો પણ આનંદ માણ્યો. જેમાં લાડુ, તલપાપડી અને ગરમાગરમ પકોડાનો સ્વાદ માણ્યો અને ચાહકો સાથે ફોટા પડાવ્યા હતા. આ પછી સાંજે અભિષેક પંજાબી સિંગર એપી દિલ્લોનાના કોન્સર્ટમાં પહોંચ્યો હતો, જ્યાં તેણે સ્ટેજ શેર કર્યું હતું. અભિષેક શર્મા વિજય હજારે ટ્રોફીમાં પંજાબ તરફથી રમી રહ્યો છે, અને સોમવારે પંજાબ અને ઉત્તરાખંડ વચ્ચેની મેચ રમાશે. પતંગ ઉડાવતી વખતે અભિષેકે ચાહકો સાથે ફોટા પણ પડાવ્યા હતા.

## રાજકોટમાં ધૂવ જુરેલે તોફાની સદી ફટકારી

(એજન્સી) રાજકોટ, ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલે વિજય હઝારે ટ્રોફીમાં પોતાની વિસ્ફોટક બેટિંગનો પરચો આપતા પોતાની વિસ્ફોટક બેટિંગની પ્રથમ સદી ફટકારી દીધી છે. ઉત્તર પ્રદેશ તરફથી બરોડા સામે રાજકોટમાં રમાઈ રહેલી મેચમાં, જુરેલે ૧૦૧ બોલમાં ૧૬૦ રનની અણનમ અને તોફાની ઈનિંગ રમી હતી. ઉલ્લેખનીય છે કે ટી-૨૦ વર્લ્ડકપ માટેની ટીમ ઈન્ડિયામાં ધ્રુવ જુરેલને પણ સ્થાન નથી મળ્યું. લાગે છે કે એનો જ ગુસ્સો એણે રાજકોટમાં વિજય હઝારે ટ્રોફીમાં બનાવતા પસંદગીકારોને જાગ્રતાંડ જવાબ આપ્યો છે. ૨૪ વર્ષીય ધ્રુવ જુરેલે નંબર ૩ પર બેટિંગમાં આવીને બરોડાના બોલરો પર શરૂઆતથી જ વળતો પ્રહાર કર્યો હતો. તેણે મેદાનની ચારે બાજુ યોગગા અને છગગાનો વરસાદ વરસાવ્યો. પોતાની સદી માત્ર ૭૮ બોલમાં પૂર્ણ કર્યા બાદ, તેણે વધુ આક્રમક રમત બતાવી અને અંતે ૧૦૧ બોલમાં ૧૫ ચોગ્ગા અને ૮ છગગાની મદદથી ૧૬૦ રન બનાવીને અણનમ રહ્યો. આ તેની વિસ્ફોટક કારકિર્દીની પ્રથમ સદી છે. ધ્રુવ જુરેલની આ શામદાર સદી ઉપરાંત, કેપ્ટન રિંકુ સિંહે પણ ૬૩ રનની વલંચપૂર્ણ ઈનિંગ રમી હતી.

### ઉત્તર ગુજરાત હિન્દુ ધોબી યુવા વિકાસ સમિતિ દ્વારા તેજસ્વી તારલાનો ૨૬ મો સન્માન સમારોહ યોજાયો



(તસ્વીર: હોશિય પટેલ, મોડાસા)

(પ્રતિનિધિ) મોડાસા, ઉત્તર ગુજરાત હિન્દુ ધોબી યુવા વિકાસ સમિતિના ઉપક્રમે બનાવ્યો હતો. કેજી થી લઈ ચેક કોલેજ ના વિવિધ ફેકલ્ટીમાં ઊંચા ગુણ પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધારનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું છાત્રોને નિ:શુલ્ક નોટબુકોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ સમારોહમાં ઉત્તર ગુજરાત હિન્દુ ધોબી યુવા વિકાસ સમિતિના પ્રમુખ તમજ અંમની ટીમ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજે આ સમારોહને આપકાર્યો હતો અનર સૌએ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

સૌના સાથ સહકાર અને સહયોગથી સમગ્ર ઉત્તર ગુજરાત

આ હિન્દુ ધોબી સમાજના ભાઈ બહેનોએ ઉપસ્થિત રહીને ઉમંગભેર સમારોહને સફળ બનાવ્યો હતો. કેજી થી લઈ ચેક કોલેજ ના વિવિધ ફેકલ્ટીમાં ઊંચા ગુણ પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધારનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું છાત્રોને નિ:શુલ્ક નોટબુકોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ સમારોહમાં ઉત્તર ગુજરાત હિન્દુ ધોબી યુવા વિકાસ સમિતિના પ્રમુખ તમજ અંમની ટીમ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમાજે આ સમારોહને આપકાર્યો હતો અનર સૌએ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.

પશ્ચિમ રેલવે- ભાવનગર ડિવિઝન	
કેન્ટીન અને રેલ કોચ રેસ્ટોરન્ટના સેવાલન માટેનો કંટાર	
કેટલોગ નંબર: MSSDRMCANRCR6220	
કારાનો પ્રકાર: DRM ઓફિસ - ભાવનગર પરના ખાતે કેન્ટીન અને ગાંધીગ્રામ રેલ્વે સ્ટેશન ખાતે રેલ કોચ રેસ્ટોરન્ટનું સંચાલનનો કંટાર.	
શ્રેણી: વિવિધ સિલે સેવાઓ	
બિયર/ટેન્ડર-૧૨૨૨૦ (I/REPS/ઓક્શન) સાર્વજનિક મુલાકાત લેવાની રહેશે અથવા વધુ પછપછ મહે વિભાગીય કાર્યાલય ભાવનગરની મુલાકાત લઈ શકાય છે અથવા ટેકેનિંગ (લાઇવલિન્ક નિરીક્ષક (NFR), ભાવનગર વિભાગ - +૯૧-૭૨૨૭૮ ૮૮૪૮૯) પર સંપર્ક કરી શકાય છે.	
દરમુજ શરૂ થવાનો સમય અને તારીખ: ૦૮.૦૧.૨૦૨૬ ના રોજ ૧:૧૦૦ કલાકે.	BVP 2૨1
લાઈવ કરો: f facebook.com/WesternRly - શ્રોતો કરો: X twitter.com/WesternRly	

AHMEDABAD MUNICIPAL CORPORATION	
MAHANAGAR SEVA SADAN	
(S.W.M. Engineering Department)	
E-TENDER NOTICE NO.40/2025-26	
<b>Name of Work:-</b>	
1. Construction of New Rcc Road at landfill site, for existing Weigh Bridge at Gyaspur Lambha Ward South Zone for Solid Waste Management Ahmedabad Municipal Coporation.	
- Tender Amount	:- Rs:- 46,56,620.00
- Date of online Submission	:- Dt:31.12.25 to Dt:20.1.26 Up to 18.00 Hrs.
- Date of physical Submission	:- Dt:21.1.26 Up to 16.00 Hrs.
- Tender Opening Date	:- Dt:22.1.26 at 17:00 Hrs.
All Details may be download of above notice will be available in <a href="http://www.tender.nprocure.com">www.tender.nprocure.com</a> and <a href="http://www.tender.nprocure.com">www.tender.nprocure.com</a>	
MUNICIPAL COMMISSNER	

## કેનેડાની હેલ્થકેર સિસ્ટમ પર ભડક્યાં ઈલોન મસ્ક

(એજન્સી) નવી દિલ્હી, કેનેડામાં ભારતીય મૂળના ૪૪ વર્ષીય પ્રશાંત શ્રીકુમારનું હોસ્પિટલમાં આઠ કલાક સુધી સારવારની રાહ જોયા બાદ કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થતાં ખળભળાટ મચી ગયો છે. આ દુ:ખદ ઘટના બાદ ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે કેનેડાની હેલ્થકેર સિસ્ટમની આકરી ટીકા કરી છે અને સરકારી મેડિકલ સેવાઓની સરખામણી ધીમી અને બેદરકાર સરકારી કચેરીઓ સાથે કરી છે. ત્રણ બાળકોના પિતા, પ્રશાંત શ્રીકુમારને ૨૨ ડિસેમ્બરે કામ દરમિયાન છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. એક કલાચટ તેમને તાત્કાલિક એડમીટના ગ્રે નન્સ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં તેમનો ઈસીજ કરવામાં આવ્યો અને દર્દશામક દવા (ટાયલેનોલ)

આપીને રાહ જોવા માટે કહેવામાં આવ્યું. પ્રશાંતે વારંવાર તીવ્ર દુખાવાની ફરિયાદ કરી હોવા છતાં, હોસ્પિટલના સ્ટાફે કથિત રીતે કહ્યું કે કંઈપણ ગંભીર નથી. લગભગ આઠ કલાક સુધી પીડામાં તરફડ્યા બાદ, આખરે જ્યારે તેમને ઈમરજન્સી સારવાર માટે લઈ જવામાં આવ્યા, ત્યારે તેઓ ત્યાં જ ઢળી પડ્યા અને થોડી જ સેકન્ડોમાં તેમનું મૃત્યુ થઈ ગયું. આ ઘટના પર મેદરકાર સરકારી કચેરીઓ સાથે સોશિયલ મીડિયા પર લખ્યું, “જ્યારે સરકાર મેડિકલ કેરનું સંચાલન કરે છે, ત્યારે તે ડીએમસી જેટલી જ સારી હોય છે.” અહીં ડીએમસી (ડિપાર્ટમેન્ટ ઓફ મોટર વ્હીકલ) નો ઉલ્લેખ કરીને મસ્કે કટાક્ષ કર્યો હતો. અમેરિકામાં લોકો વારંવાર ડીએમવીની ધીમી અને

બેદરકારીભરી કામગીરીની ટીકા કરે છે, જે ફાઈવિંગ લાઈસન્સ અને વાહન નોંધણી જેવી સેવાઓ સંબાળે છે. આ ઘટના બાદ પ્રશાંતની પત્નીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે પોતાના પતિના મૃતદેહ પાસે ઉભી રહીને રડી રહી હતી અને કહી રહી હતી કે, “ખરેખર, ગ્રે નન્સ સીમ્યુનેટી હોસ્પિટલના વલીવટીતંત્ર અને સ્ટાફે મારા પતિને સમયસર તબીબી સહાય ન આપીને મારી નાખ્યા છે.” આ ઘટના બાદ, કેનેડિયન સ્વાસ્થ્ય અધિકારીઓએ ગોપનીયતાની ચિતાઓને કારણે દર્દીની સંભાળની વિગતો પર ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. જોકે, તેમણે પુષ્ટિ કરી કે આ મામલાને સમીક્ષા માટે ચીફ મેડિકલ એક્ઝામિનરની ઓફિસમાં મોકલવામાં આવ્યો છે.

## સૌથી મોટા ભાગેડુ વાળા વીડિયો પર લલિત મોદીએ માંગી માફી

(એજન્સી) લંડન, ઈન્ડિયન પ્રીમિયર લીગના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ